

Sun Pharmaceutical Industries Limited

Sun House, Plot No. 201 B/1,
Western Express Highway, Goregaon (E),
Mumbai – 400 063, Maharashtra, INDIA.
Tel.: (91-22) 4324 4324
Fax: (91-22) 4324 4343
Website: www.sunpharma.com
Email: secretarial@sunpharma.com
CIN: L24230GJ1993PLC019050



24 September 2025

National Stock Exchange of India Limited
Scrip Symbol: SUNPHARMA

BSE Limited
Scrip Code: 524715

Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 – Newspaper Advertisements

This is to inform that the Investor Education and Protection Fund (“IEPF”) Authority, Ministry of Corporate Affairs (MCA), vide its letter dated 16 July 2025, has launched a 100 Days Campaign – “Saksham Niveshak”, from 28 July 2025 to 06 November 2025, to reach out to the shareholders whose dividends have remained unclaimed before they get transferred to the IEPF.

The Company takes various facilitation measures to reduce unclaimed dividends, updating KYC and bank mandates from time to time to prevent the transfer of unpaid/unclaimed dividends and shares to IEPF.

As part of the Company’s effort to support the campaign, the Company has issued relevant communication through various modes such as individual notice(s), emails and SMS etc., Further, the Company has also published newspaper advertisements [All editions of Financial Express (in English) and Ahmedabad Edition of Financial Express (in Gujarati)] on 24 September 2025 to create awareness amongst the shareholders regarding the 100 Days Campaign “Saksham Niveshak” and update KYC details and claim unpaid dividends in order to prevent transfer to IEPF. Copies of newspaper clippings are attached as **Annexure-A**, which is also available on the Company’s website at www.sunpharma.com.

For Sun Pharmaceutical Industries Limited

(Anoop Deshpande)
Company Secretary and Compliance Officer
Nodal Officer for the purpose of IEPF
ICSI Membership No.: A23983

Sr no	Category	No. of Applications Received	% of Total	Total No. of Equity Shares applied	% to Total	No. of Equity Shares allotted per applicant	Ratio	Total No. of Equity Shares allotted
37	7350	3	0.00	22,050	0.01	2,100	0 : 3	0
38	7500	26	0.03	195,000	0.10	2,100	0 : 26	0
39	7650	2	0.00	15,300	0.01	2,100	0 : 2	0
40	7800	10	0.01	78,000	0.04	2,100	0 : 10	0
41	7950	7	0.01	55,650	0.03	2,100	0 : 7	0
42	8100	10	0.01	81,000	0.04	2,100	0 : 10	0
43	8250	4	0.00	33,000	0.02	2,100	0 : 4	0
44	8400	36	0.04	302,400	0.16	2,100	0 : 36	0
45	8550	4	0.00	34,200	0.02	2,100	0 : 4	0
46	8700	2	0.00	17,400	0.01	2,100	0 : 2	0
47	8850	2	0.00	17,700	0.01	2,100	0 : 2	0
48	9000	23	0.03	207,000	0.11	2,100	0 : 23	0
49	9150	7	0.01	64,050	0.03	2,100	0 : 7	0
50	9300	2	0.00	18,600	0.01	2,100	0 : 2	0
51	9450	3	0.00	28,350	0.01	2,100	0 : 3	0
52	9600	3	0.00	28,800	0.02	2,100	0 : 3	0
53	9750	25	0.03	243,750	0.13	2,100	0 : 25	0
54	9900	10	0.01	99,000	0.05	2,100	0 : 10	0
55	Sino 12 to 54	-	0.00	-	0.00	2,100	4 : 933	8,400
56	Sino 2 to 54 (Allottees)	-	0.00	-	0.00	16	1 : 1	384
57	Sino 2 to 54 (Allottees)	-	0.00	-	0.00	1	2 : 3	16
	Total	87,849	100.00	191,488,200	100.00			1,000,000

Please Note : 1 (One) lot of 2100 shares have been allocated to all the Applicants from Serial No. 12 to 54 in the ratio of 4 : 933 (All these categories have been moved at the end for easy reference)

Please Note : 16 additional Shares have been allocated to all the 24 Successful Allottees in Categories from Sino 2 to Sino 54 (i.e.excluding successful applicants from Category 2100) in the ratio of 1 : 1

Please Note : 1 additional share has been allocated to all the 24 Successful Allottees in Categories from Sino 2 to Sino 54 (i.e.excluding successful applicants from Category 2100) in the ratio of 2:3

C. Allotment to Non-Institutional Investors (above ₹10 lakhs) (After Rejections) (including ASBA Applications)

The Basis of Allotment to the Non-Institutional Investors (above ₹10 lakhs), who have bid at the Issue Price of ₹ 99 per Equity Share or above, was finalized in consultation with BSE. This category has been subscribed to the extent of 243.54795 times. The total number of Equity Shares allotted in this category is 2,000,000 Equity Shares to 952 successful applicants. The category-wise details of the Basis of Allotment are as under: (Sample)

Sr no	Category	No. of Applications Received	% of Total	Total No. of Equity Shares applied	% to Total	No. of Equity Shares allotted per applicant	Ratio	Total No. of Equity Shares allotted
1	10200	45,311	96.19	462,172,200	94.88	2,100	133 : 6579	1,923,600
2	10350	398	0.84	4,119,300	0.85	2,100	4 : 199	16,800
3	10500	512	1.09	5,376,000	1.10	2,100	5 : 256	21,000
4	10650	103	0.22	1,096,950	0.23	2,100	2 : 103	4,200
5	10800	78	0.17	842,400	0.17	2,100	1 : 39	4,200
6	10950	90	0.19	985,500	0.20	2,100	1 : 45	4,200
7	11100	27	0.06	299,700	0.06	2,100	1 : 27	2,100
109	75000	1	0.00	75,000	0.02	2,100	0 : 1	0
110	80700	1	0.00	80,700	0.02	2,100	0 : 1	0
111	101100	2	0.00	202,200	0.04	2,100	0 : 2	0
112	101250	1	0.00	101,250	0.02	2,100	0 : 1	0
113	102000	5	0.01	510,000	0.10	2,100	0 : 5	0
114	150000	1	0.00	150,000	0.03	2,100	0 : 1	0
115	151650	1	0.00	151,650	0.03	2,100	0 : 1	0
116	201900	1	0.00	201,900	0.04	2,100	0 : 1	0
117	210000	1	0.00	210,000	0.04	2,100	0 : 1	0
118	252450	1	0.00	252,450	0.05	2,100	0 : 1	0
119	300000	1	0.00	300,000	0.06	2,100	0 : 1	0
120	Sino 14 to 119	-	0.00	-	0.00	2,100	5 : 336	10,500
121	Sino 1 to 119 (Allottees)	-	0.00	-	0.00	1	100 : 119	800
	Total	47,105	100.00	487,095,900	100.00			2,000,000

Please Note : 1 (One) lot of 2100 shares have been allocated to All the Applicants from Serial No. 14 to 119 in the ratio of 5:336 (All these categories have been moved at the end for easy reference)

Please Note : 1 additional share has been allocated to all 952 Successful Allottees from all the Categories in the ratio of 100 : 119

D. Allotment to QIBs (After Rejections)

Allotment to QIBs, who have bid at the Issue Price of ₹ 99 per Equity Share or above, has been done on a proportionate basis in consultation with BSE. This category has been subscribed to the extent of 118.06100 times of Net QIB portion. As per the SEBI ICDR Regulations, Mutual Funds were allotted 5% of the Equity Shares of Net QIB portion available i.e. 90,000 Equity Shares and other QIBs and unsatisfied demand of Mutual Funds were allotted the remaining available Equity Shares i.e. 1,710,000 Equity Shares on a proportionate basis. The total number of Equity Shares allotted in the QIB category is 1,800,000 Equity Shares, which were allotted to 43 successful Applicants. The category-wise details of the Basis of Allotment are as under:

Category	FI'S/BANK'S	MF'S	IC'S	NBFC'S	AIF	FPC/FII	Others	Total
QIB	681,867	92,934	100,502	-	-	221,221	703,476	1,800,000

E. Allotment to Anchor Investors (After Rejections)

The Company, in consultation with the BRLMs, have allocated 2,700,000 Equity Shares to 5 Anchor Investors (through 5 Applications) at the Anchor Investor Issue Price of ₹ 99 per Equity Share in accordance with the SEBI Regulations. This represents 60% of the QIB Portion.

Category	FI'S/ BANK'S	MF'S	IC'S	NBFC'S	AIF	FPC/FII	OTHERS	Total
ANCHOR	-	-	-	-	1,083,450	1,616,550	-	2,700,000

The Company on September 22, 2025 has taken on record the Basis of Allotment of Equity Shares approved by the Designated Stock Exchange, being BSE and has allotted the Equity Shares to various successful Bidders. The Allotment Advice-cum-Intimations and/ or notices have been dispatched to the address of the investors as registered with the depositories. Further, the instructions to the Self Certified Syndicate Banks for unblocking of funds, transfer to Public Issue Account have been issued on September 22, 2025 and payment to non-Syndicate brokers have been issued on September 23, 2025. In case the same is not received within ten days, investors may contact the Registrar to the Issue at the address given below. The Equity Shares Allotted to the successful Allottees have been uploaded on September 23, 2025 for credit into the respective beneficiary accounts subject to validation of the account details with the depositories concerned. The Company has filed the Listing application with BSE and NSE on September 23, 2025 The Company has received listing and trading approval from BSE and NSE and the trading will commence on or about September 24, 2025.

Note: All capitalised terms used and not specifically defined herein shall have the same meaning as ascribed to them in the Prospectus.

INVESTORS PLEASE NOTE

The details of the allotment made will be hosted on the website of the Registrar to the Issue, KFin Technologies Limited at www.kfintech.com

All future correspondence in this regard may kindly be addressed to the Registrar to the Issue quoting full name of the First/ sole Bidder, Bid cum Application Form number, Bidder DP ID, Client ID, PAN, date of submission of Bid-cum-Application Form, address of the Bidder, number of Equity Shares applied for, the name and address of the Designated Intermediary where the Bid cum Application Form was submitted by the Bidder and a copy of the Acknowledgment Slip received from the Designated Intermediary at the address given below:



KFin Technologies Limited

Selenium Building, Tower-B, Plot No. 31 & 32,
Financial District, Nanakramguda, Serilingampally Hyderabad,
Rangareddi-500032, Telangana, India
Telephone: +91 40 67162222
E-mail: vms.ipo@kfintech.com
Website: www.kfintech.com
Investor grievance e-mail: einward.ris@kfintech.com
Contact person: M. Murali Krishna
SEBI registration number: INR000000221

For **VMS TMT LIMITED**
On behalf of the Board of Directors

Sd/

Boliya Vijay Amrabhai

Company Secretary and Compliance Officer

Date: September 23, 2025
Place: Ahmedabad

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES ON LISTING OR THE BUSINESS PROSPECTS OF VMS TMT LIMITED.

VMS TMT LIMITED has filed the Prospectus dated September 19, 2025 with RoC. The Prospectus is available on the website of SEBI at www.sebi.gov.in, websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com – where equity shares are proposed to be listed, on the website of the Company i.e. www.vmsmtm.com and the website of the Book Running Lead Manager ("**BRLM**"), i.e. Arihant Capital Markets Limited at www.arihantcapital.com. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled "*Risk Factors*" on page 30 of the Prospectus.

The Equity Shares offered in the Issue have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the "U.S. Securities Act") or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and in accordance with any applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold only outside the United States in 'offshore transactions' as defined in, and in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdictions where such offers and sales are made.

WELSPUN CORP LIMITED
(CIN : L27100GJ1995PLC025609)
Regd. Office: Welspun City, Village Vershed, Taluka Anjar, Dist. Kutch, Gujarat - 370110.
Tel No. +91 2836 662079 Fax : +91 2836 279060.
Corp. Office: Welspun House, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai-400013. Tel.No. 022 - 6613 8000, Fax: 022 - 2490 8020
CompanySecretary_WCL@welspun.com www.welspuncorp.com

Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares of Welspun Corp Limited

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/PI/CIR/2025/97 dated July 2, 2025, all Shareholders of the Company are hereby informed that a Special Window is open for a period of six months, from July 7, 2025 till January 6, 2026 for re-lodgement of transfer requests of physical shares, which were lodged prior to the deadline of April 1, 2019 and rejected/ returned/ not attended to due to deficiency in the documents / process/ or otherwise. Investors who have missed earlier deadline of March 31, 2021 (the cut-off date for re-lodgement of transfer deeds) can take this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and Transfer Agent M/s MUFG Intime India Private Limited (Formerly known as Link Intime India Private Ltd), C-101, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai -400083, Tel:+918108116767/18001020878, Email id: rm.helpdesk@in.mgms.mufg.com

For Welspun Corp Limited

Kamal Rathi
Company Secretary

Mumbai, September 23, 2025

KAYCEE INDUSTRIES LIMITED
(CIN : L70102MH1942PLC006482)
REGD OFFICE :- 32, Ramjibhai Kamani Rd, Ballard Estate, Mumbai 400001
Phone No. +91 22 22613521; Website:- www.kayceindustries.com Mail: cs@kayceindustries.com

NOTICE OF POSTAL BALLOT/REMOTE E-VOTING

Members are hereby informed that pursuant to Sections 108 and 110, and other applicable provisions of the Companies Act, 2013, as amended ("the Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014, the applicable provisions of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standard-2 issued by Institute of Company Secretaries of India (ICSI) and in accordance with various circulars issued from time to time by the Ministry of Corporate Affairs ("the MCA Circulars"), read with various circulars issued from time to time by Securities Exchange Board of India ("SEBI") and any other applicable law, rules, circulars, notifications and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), that the special resolution appended below, be passed by the members of the Company (as on the Cut-off Date), through postal ballot ("the Postal Ballot") only by way of remote e-voting ("e-voting") for the following special business:

1 Appointment of Mr. Raman Krishnamoorthy (DIN: 10766058) as a Whole Time Director on the Board of Kaycee Industries Limited (the "Company") for a term of three years with effect from August 02, 2025.

In Compliance with the MCA Circulars the Postal Ballot Notice dated Friday, September 12, 2025 along with instructions regarding e-voting has been sent only through email on Tuesday, September 23, 2025 to all those Members whose email address is registered with the Company/Registrar & Share Transfer Agent and whose names appears in this register if members or list of beneficial owners as on the cut-off date i.e Saturday, September 20, 2025 and voting rights shall be reckoned on the shares registered in the name of the Shareholder as on the same date. Any person who is not a shareholder of the Company on the cut-off date shall treat the Postal Ballot Notice for information purpose only.

The Notice is also available on the website of the company, i.e., www.kayceindustries.com on the website of the Stock Exchange i.e BSE Limited at www.bseindia.com and on the e-voting website of National Securities Depositories Limited ("NSDL") at www.evoting.nsdl.com.

The Company has engaged the services of NSDL to provide e-voting facility. The e-voting facility will be available during the following period;

Commencement of e-voting	9:00 AM (IST) on Saturday, 27th September 2025
End of e-voting	5:00 PM (IST) on Sunday, 28th October 2025

The e-voting module shall be disable by NSDL immediately after 5:00 PM (IST) on Sunday, 26th October 2025. Members who have not update their email address are requested to registered the same in respect of shares held by them in electronic form with the Depository thought their Depository Participants and in respect of shares held in physical form by writing to the Company/Company's RTA, Datamatics Business Solutions Limited at investors@dtsl.com or by post to Plot No A16 & 17, Part B, Crosslane, MIDC, Marol, Andheri East, Mumbai, Maharashtra, 400093.

Mr. Ashish Doshi (Membership No. FCS 9321) (CP No. 10190) Practicing Company Secretary has been appointed by the board of Director of the Company as the "Scrutinizer" to scrutinise the Postal Ballot / e-voting process in a fair and transparent manner.

The result of the Postal Ballot will be declared within 2 working days from the conclusion of the e-voting and displayed at the Registered as well as Corporate Office of the Company. The Result shall also be announced and uploaded to the Company's website www.kayceindustries.com and on the of the Stock Exchange i.e BSE Limited at www.bseindia.com and on the e-voting website of National Securities Depositories Limited ("NSDL") at www.evoting.nsdl.com. The resolutions, if passed with requisite majority shall be deemed to have been passed on the last date specified by the Company for e-voting i.e. Sunday, 26th October 2025. In case of any queries related to e-voting, you may refer the Help/Frequently Asked Questions ("Help/ FAQs") and e-voting user manual available at the download section of www.evoting.nsdl.com For any grievances connected with facility for e-voting please contact Ms. Rimpoo Bag at e-mail: e-voting@nsdl.com or toll free no. 022-48867000.

Members are requested to carefully read all the notes set out in the Notice and in particular, the manner of casting vote through remote e-voting.

Special window for re-lodgement of transfer request:

SEBI has allowed a special window from July 7, 2025 to January 6, 2026 for re-lodgement of physical share transfer requests lodged before April 1, 2019, but rejected/returned due to deficiencies. Shareholders are requested to submit original transfer documents with corrected/missing details to the Company's RTA. Please refer SEBI Circular: SEBI/HO/MIRSD/MIRSD-PoD/PI/CIR/2025/97 dated July 02, 2025 for further details.

By order of the Board of Directors
For Kaycee Industries Limited
Sd/-
Sanjay Prasadth Naresimhan
Company Secretary & Compliance Officer
ICSI Membership Number : A71514

Place:- Mumbai
Date:- September 24, 2025

Sun Pharmaceutical Industries Limited
Regd. Office: SPARC, Tandajia, Vadodara - 390 012, Gujarat, India
Corporate Office: Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon - East, Mumbai - 400 063, Maharashtra, India
Tel: 022-43244324 CIN: L24230GJ1993PLC019050
Website: www.sunpharma.com Email: secretarial@sunpharma.com

NOTICE TO SHAREHOLDERS

To update KYC and claim unpaid dividends

The Company takes various facilitation measures to reduce unclaimed dividends, updating KYC and bank mandates from time to time to prevent the transfer of unpaid/unclaimed dividends and shares to the Investor Education and Protection Fund (IEPF).

The IEPF Authority has also launched a 100-Day Campaign, "Saksham Niveshak," starting from 28 July 2025 to 06 November 2025, for KYC and other related updates, and collaborative efforts are being taken. The objective of this campaign is to facilitate shareholders for,

- Updating Know Your Customer (KYC) details, including Bank account mandates, Nominee registration, and Contact information - Email, Mobile number, Address, etc.,
- Claiming unpaid/unclaimed dividends for any financial year(s) in order to prevent transfer to IEPF.

The Company has released communications to the concerned shareholders whose dividends remained unclaimed through individual notice(s), emails and SMS so that appropriate action(s) can be taken to claim the unpaid dividend.

The shareholders who have not yet claimed the dividends or have incomplete KYC records are requested to contact the Company's Registrar and Share Transfer Agenda, MUFG Intime India Private Limited, C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083, Phone: +91-8108116767, website: https://web.in.mgms.mufg.com/helpdesk/Service_Request.html at the earliest. Additionally, shareholders are encouraged to register and track their requests through the SWAYAM portal: <https://swayam.in.mgms.mufg.com>

Important Advisory

Please note that, as per applicable provisions, if dividends remain unclaimed for seven consecutive years, the dividend amounts and corresponding base shares, if any, shall be transferred to the IEPF. We urge all shareholders to take prompt action during the campaign period to safeguard their entitlements and ensure compliance with statutory requirements.

For Sun Pharmaceutical Industries Limited
(Anoop Deshpande)
Company Secretary and Compliance Officer
Nodal Officer for the purpose of IEPF
ICSI Membership No. A23983

Place: Mumbai
Date: 23 September 2025

HSBC MUTUAL FUND
NOTICE

Notice is hereby given that the Trustees of HSBC Mutual Fund have approved the declaration of dividends under the Income Distribution cum Capital Withdrawal (IDCW) option of the following scheme of HSBC Mutual Fund:

Sr. No.	Scheme/ Plan/ Option	Quantum of Dividend (in ₹ per unit)	NAV of the IDCW Option (as on September 22, 2025) (in ₹ per unit)
1.	HSBC Arbitrage Fund - Regular Plan - Quarterly IDCW Option	0.22	10.9979
2.	HSBC Arbitrage Fund - Direct Plan - Quarterly IDCW Option	0.25	11.1984

Record Date: September 26, 2025. Face Value: Rs 10 per unit

The above dividend is subject to availability of distributable surplus and may be lower to the extent of distributable surplus available on the record date. **Pursuant to payment of dividend, the NAV of the IDCW option of the above-mentioned scheme/ plans will fall to the extent of dividend distribution and statutory levy, if any.**

All the unitholders of the above scheme whose names appear on the register of unitholders as on the record date will be eligible to receive the dividend.

For & on behalf of **HSBC Asset Management (India) Private Limited**
(Investment Manager to HSBC Mutual Fund)

Sd/-

Authorised Signatory
Mumbai, September 23, 2025



Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

HSBC Asset Management (India) Private Limited, 9-11 Floors, NESCO IT Park, Building no. 3, Western Express Highway, Goregaon (East), Mumbai – 400 063, India.
Email: investor.line@mutualfunds.hsbc.co.in, Website: www.assetmanagement.hsbc.co.in
Customer Service Number - 1800 200 2434/ 1800 4190 200
Issued by HSBC Asset Management (India) Private Limited
CIN-U74140MH2001PTC134220

Sr no	Category	No. of Applications Received	% of Total	Total No. of Equity Shares applied	% to Total	No. of Equity Shares allotted per applicant	Ratio	Total No. of Equity Shares allotted
37	7350	3	0.00	22,050	0.01	2,100	0 : 3	0
38	7500	26	0.03	195,000	0.10	2,100	0 : 26	0
39	7650	2	0.00	15,300	0.01	2,100	0 : 2	0
40	7800	10	0.01	78,000	0.04	2,100	0 : 10	0
41	7950	7	0.01	55,650	0.03	2,100	0 : 7	0
42	8100	10	0.01	81,000	0.04	2,100	0 : 10	0
43	8250	4	0.00	33,000	0.02	2,100	0 : 4	0
44	8400	36	0.04	302,400	0.16	2,100	0 : 36	0
45	8550	4	0.00	34,200	0.02	2,100	0 : 4	0
46	8700	2	0.00	17,400	0.01	2,100	0 : 2	0
47	8850	2	0.00	17,700	0.01	2,100	0 : 2	0
48	9000	23	0.03	207,000	0.11	2,100	0 : 23	0
49	9150	7	0.01	64,050	0.03	2,100	0 : 7	0
50	9300	2	0.00	18,600	0.01	2,100	0 : 2	0
51	9450	3	0.00	28,350	0.01	2,100	0 : 3	0
52	9600	3	0.00	28,800	0.02	2,100	0 : 3	0
53	9750	25	0.03	243,750	0.13	2,100	0 : 25	0
54	9900	10	0.01	99,000	0.05	2,100	0 : 10	0
55	Sino 12 to 54	-	0.00	-	0.00	2,100	4 : 933	8,400
56	Sino 2 to 54 (Allottees)	-	0.00	-	0.00	16	1 : 1	384
57	Sino 2 to 54 (Allottees)	-	0.00	-	0.00	1	2 : 3	16
	Total	87,849	100.00	191,488,200	100.00			1,000,000

Please Note : 1 (One) lot of 2100 shares have been allocated to all the Applicants from Serial No. 12 to 54 in the ratio of 4 : 933 (All these categories have been moved at the end for easy reference)

Please Note : 16 additional Shares have been allocated to all the 24 Successful Allottees in Categories from Sino 2 to Sino 54 (I.e.excluding successful applicants from Category 2100) in the ratio of 1 : 1

Please Note : 1 additional share has been allocated to all the 24 Successful Allottees in Categories from Sino 2 to Sino 54 (I.e.excluding successful applicants from Category 2100) in the ratio of 2:3

C. Allotment to Non-Institutional Investors (above ₹10 lakhs) (After Rejections) (including ASBA Applications)

The Basis of Allotment to the Non-Institutional Investors (above ₹10 lakhs), who have bid at the Issue Price of ₹ 99 per Equity Share or above, was finalized in consultation with BSE. This category has been subscribed to the extent of 243.54795 times. The total number of Equity Shares allotted in this category is 2,000,000 Equity Shares to 952 successful applicants. The category-wise details of the Basis of Allotment are as under: (Sample)

Sr no	Category	No. of Applications Received	% of Total	Total No. of Equity Shares applied	% to Total	No. of Equity Shares allotted per applicant	Ratio	Total No. of Equity Shares allotted
1	10200	45,311	96.19	462,172,200	94.88	2,100	133 : 6579	1,923,600
2	10350	398	0.84	4,119,300	0.85	2,100	4 : 199	16,800
3	10500	512	1.09	5,376,000	1.10	2,100	5 : 256	21,000
4	10650	103	0.22	1,096,950	0.23	2,100	2 : 103	4,200
5	10800	78	0.17	842,400	0.17	2,100	1 : 39	4,200
6	10950	90	0.19	985,500	0.20	2,100	1 : 45	4,200
7	11100	27	0.06	299,700	0.06	2,100	1 : 27	2,100
109	75000	1	0.00	75,000	0.02	2,100	0 : 1	0
110	80700	1	0.00	80,700	0.02	2,100	0 : 1	0
111	101100	2	0.00	202,200	0.04	2,100	0 : 2	0
112	101250	1	0.00	101,250	0.02	2,100	0 : 1	0
113	102000	5	0.01	510,000	0.10	2,100	0 : 5	0
114	150000	1	0.00	150,000	0.03	2,100	0 : 1	0
115	151650	1	0.00	151,650	0.03	2,100	0 : 1	0
116	201900	1	0.00	201,900	0.04	2,100	0 : 1	0
117	210000	1	0.00	210,000	0.04	2,100	0 : 1	0
118	252450	1	0.00	252,450	0.05	2,100	0 : 1	0
119	300000	1	0.00	300,000	0.06	2,100	0 : 1	0
120	Sino 14 to 119	-	0.00	-	0.00	2,100	5 : 336	10,500
121	Sino 1 to 119 (Allottees)	-	0.00	-	0.00	1	100 : 119	800
	Total	47,105	100.00	487,095,900	100.00			2,000,000

Please Note : 1 (One) lot of 2100 shares have been allocated to All the Applicants from Serial No. 14 to 119 in the ratio of 5 :336 (All these categories have been moved at the end for easy reference)

Please Note : 1 additional share has been allocated to all 952 Successful Allotees from all the Categories in the ratio of 100 : 119

D. Allotment to QIBs (After Rejections)

Allotment to QIBs, who have bid at the Issue Price of ₹ 99 per Equity Share or above, has been done on a proportionate basis in consultation with BSE. This category has been subscribed to the extent of 118.06100 times of Net QIB portion. As per the SEBI ICDR Regulations, Mutual Funds were allotted 5% of the Equity Shares of Net QIB portion available i.e. 90,000 Equity Shares and other QIBs and unsatisfied demand of Mutual Funds were allotted the remaining available Equity Shares i.e. 1,710,000 Equity Shares on a proportionate basis. The total number of Equity Shares allotted in the QIB category is 1,800,000 Equity Shares, which were allotted to 43 successful Applicants. The category-wise details of the Basis of Allotment are as under:

Category	FI'S/BANK'S	MF'S	IC'S	NBFC'S	AIF	FPC/FII	Others	Total
QIB	681,867	92,934	100,502	-	-	221,221	703,476	1,800,000

E. Allotment to Anchor Investors (After Rejections)

The Company, in consultation with the BRLMs, have allocated 2,700,000 Equity Shares to 5 Anchor Investors (through 5 Applications) at the Anchor Investor Issue Price of ₹ 99 per Equity Share in accordance with the SEBI Regulations. This represents 60% of the QIB Portion.

Category	FI'S/ BANK'S	MF'S	IC'S	NBFC'S	AIF	FPC/FII	OTHERS	Total
ANCHOR	-	-	-	-	1,083,450	1,616,550	-	2,700,000

The Company on September 22, 2025 has taken on record the Basis of Allotment of Equity Shares approved by the Designated Stock Exchange, being BSE and has allotted the Equity Shares to various successful Bidders. The Allotment Advice-cum-Intimations and/ or notices have been dispatched to the address of the investors as registered with the depositories. Further, the instructions to the Self Certified Syndicate Banks for unblocking of funds, transfer to Public Issue Account have been issued on September 22, 2025 and payment to non-Syndicate brokers have been issued on September 23, 2025. In case the same is not received within ten days, investors may contact the Registrar to the Issue at the address given below. The Equity Shares Allotted to the successful Allottees have been uploaded on September 23, 2025 for credit into the respective beneficiary accounts subject to validation of the account details with the depositories concerned. The Company has filed the Listing application with BSE and NSE on September 23, 2025 The Company has received listing and trading approval from BSE and NSE and the trading will commence on or about September 24, 2025.

Note: All capitalised terms used and not specifically defined herein shall have the same meaning as ascribed to them in the Prospectus.

INVESTORS PLEASE NOTE

The details of the allotment made will be hosted on the website of the Registrar to the Issue, KFin Technologies Limited at www.kfintech.com

All future correspondence in this regard may kindly be addressed to the Registrar to the Issue quoting full name of the First/ sole Bidder, Bid cum Application Form number, Bidder DP ID, Client ID, PAN, date of submission of Bid-cum-Application Form, address of the Bidder, number of Equity Shares applied for, the name and address of the Designated Intermediary where the Bid cum Application Form was submitted by the Bidder and a copy of the Acknowledgment Slip received from the Designated Intermediary at the address given below:



KFin Technologies Limited

Selenium Building, Tower-B, Plot No. 31 & 32,
Financial District, Nanakramguda,Serilingampally Hyderabad,
Rangareddi-500032, Telangana, India
Telephone: +91 40 67162222
E-mail: vms.ipo@kfintech.com
Website: www.kfintech.com
Investor grievance e-mail: einward.ris@kfintech.com
Contact person: M. Murali Krishna
SEBI registration number: INR000000221

For **VMS TMT LIMITED**
On behalf of the Board of Directors

Sd/
Boliya Vijay Amrabhai
Company Secretary and Compliance Officer

Date: September 23, 2025
Place: Ahmedabad

THE LEVEL OF SUBSCRIPTION SHOULD NOT BE TAKEN TO BE INDICATIVE OF EITHER THE MARKET PRICE OF THE EQUITY SHARES ON LISTING OR THE BUSINESS PROSPECTS OF VMS TMT LIMITED.

VMS TMT LIMITED has filed the Prospectus dated September 19, 2025 with RoC. The Prospectus is available on the website of SEBI at www.sebi.gov.in, websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com – where equity shares are proposed to be listed, on the website of the Company i.e. www.vmsmtm.com and the website of the Book Running Lead Manager (“BRLM”), i.e. Arihant Capital Markets Limited at www.arihantcapital.com. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled “Risk Factors” on page 30 of the Prospectus.

The Equity Shares offered in the Issue 'have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (the “U.S. Securities Act”) or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and in accordance with any applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold only outside the United States in ‘offshore transactions’ as defined in, and in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdictions where such offers and sales are made.

**WELSPUN CORP LIMITED**
(CIN - L27100GJ1995PLC025609)
Regd. Office: Welspun City, Village Versamedi, Taluka Anjar, Dist. Kutch, Gujarat - 370110.
Tel No. +91 2636 682079 Fax : +91 2836 279060.
Corp. Office: Welspun House, Kamla Mills Compound, Senapati Bapat Marg, Lower Panel, Mumbai-400013. Tel No. 022 - 6613 6000. Fax: 022 - 2490 8020
CompanySecretary_WCL@welspun.com www.welspuncorp.com

Special Window for Re-lodgement of Transfer Requests of Physical Shares of Welspun Corp Limited

Pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/PI/CIR/2025/97 dated July 2, 2025, all Shareholders of the Company are hereby informed that a Special Window is open for a period of six months, from July 7, 2025 till January 6, 2026 for re-lodgement of transfer requests of physical shares, which were lodged prior to the deadline of April 1, 2019 and rejected/ returned/ not attended to due to deficiency in the documents/ process/ or otherwise. Investors who have missed earlier deadline of March 31, 2021 (the cut-off date for re-lodgement of transfer deeds) can take this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and Transfer Agent M/s MUFG Intime India Private Limited (Formerly known as Link Intime India Private Ltd), C-101, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai -400083, Tel:+918108116767/18001020878, Email id: mt.helpdesk@in.mpgms.mufg.com

For Welspun Corp Limited

Kamal Rathi
Company Secretary

Mumbai, September 23, 2025

**KAYCEE INDUSTRIES LIMITED**
(CIN : L70102MH1942PLC006482)
REGD OFFICE:- 32, Ramjibhai Kamani Rd, Ballard Estate, Mumbai 400001
Phone No. + 91 22 22613521, Website:- www.kayceeindustries.com Mail: cs@kayceeindustries.com

NOTICE OF POSTAL BALLOT/REMOTE E-VOTING

Members are hereby informed that pursuant to Sections 108 and 110, and other applicable provisions of the Companies Act, 2013, as amended ("the Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014, the applicable provisions of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standard-2 issued by Institute of Company Secretaries of India (ICSI) and in accordance with various circulars issued from time to time by the Ministry of Corporate Affairs ("the MCA Circulars"), read with various circulars issued from time to time by Securities Exchange Board of India ("SEBI") and any other applicable law, rules, circulars, notifications and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), that the special resolution appended below, be passed by the members of the Company (as on the Cut-off Date), through postal ballot ("the Postal Ballot") only by way of remote e-voting ("e-voting") for the following special business:

1. Appointment of Mr. Raman Krishnamoorthy (DIN: 10766058) as a Whole Time Director on the Board of Kaycee Industries Limited (the "Company") for a term of three years with effect from August 02, 2025.

In Compliance with the MCA Circulars the Postal Ballot Notice dated Friday, September 12, 2025 along with instructions regarding e-voting has been sent only through email on Tuesday, September 23, 2025 to all those Members whose email address is registered with the Company/Registrar & Share Transfer Agent and whose names appears in this register if members or list of beneficial owners as on the cut-off date i.e Saturday, September 20, 2025 and voting rights shall be reckoned on the shares registered in the name of the Shareholder as on the same date. Any person who is not a shareholder of the Company on the cut-off date shall treat the Postal Ballot Notice for information purpose only.

The Notice is also available on the website of the company, i.e., www.kayceeindustries.com on the website of the Stock Exchange i.e BSE Limitedat www.bseindia.com and on the e-voting website of National Securities Depositories Limited ("NSDL") at www.evoting.nsdl.com.

The Company has engaged the services of NSDL to provide e-voting facility. The e-voting facility will be available during the following period:

Commencement of e-voting	9:00 AM (IST) on Saturday, 27th September 2025
End of e-voting	5:00 PM (IST) on Sunday, 28th October 2025

The e-voting module shall be disable by NSDL immediately after 5:00 PM (IST) on Sunday, 26th October 2025. Members who have not update their email address are requested to registered the same in respect of shares held by them in electronic form with the Depository thought their Depository Participants and in respect of shares held in physical form by writing to the Company/Company's RTA, Datamatics Business Solutions Limited at investorsqy@dbssl.com or by post to Plot No A16 & 17, Part B, Crosslane, MIDC, Marol, Andheri East, Mumbai, Maharashtra, 400093.

Mr. Aashit Doshi (Membership No. FCS 9321) (CP No. 10190) Practicing Company Secretary has been appointed by the Board of Director of the Company as the "Scrutinizer" to scrutinize the Postal Ballot / e-voting process in a fair and transparent manner.

The result of the Postal Ballot will be declared within 2 working days from the conclusion of the e-voting and displayed at the Registered as well as Corporate Office of the Company. The Result shall also be announced and uploaded to the Company's website www.kayceeindustries.com and on the of the Stock Exchange i.e BSE Limited at www.bseindia.com and on the e-voting website of National Securities Depositories Limited ("NSDL") at www.evoting.nsdl.com. The resolutions, if passed with requisite majority shall be deemed to have been passed on the last date specified by the Company for e-voting i.e. Sunday, 26th October 2025.

In case of any queries related to e-voting, you may refer the Help/Frequently Asked Questions ("Help/FAQs") and e-voting user manual available at the download section of www.evoting.nsdl.com For any grievances connected with facility for e-voting please contact Ms. Rimpia Bag at e-mail: e-voting@nsdl.com or toll free no. 022-48867000.

Members are requested to carefully read all the notes set out in the Notice and in particular, the manner of casting vote through remote e-voting.

Special window for re-lodgement of transfer request:

SEBI has allowed a special window from July 7, 2025 to January 6, 2026 for re-lodgement of physical share transfer requests lodged before April 1, 2019, but rejected/returned due to deficiencies. Shareholders are requested to submit original transfer documents with corrected/missing details to the Company's RTA. Please refer SEBI Circular: SEBI/HO/MIRSD/MIRSD-PoD/PI/CIR/2025/97 dated July 02, 2025 for further details.

By order of the Board of Directors
For Kaycee Industries Limited
Sd/-
Sanjay Prasanth Narasimhan
Company Secretary & Compliance Officer
ICSI Membership Number : A71514

Place:- Mumbai
Date:- September 24, 2025

**Sun Pharmaceutical Industries Limited**
Regd. Office: SPARC, Tandajia, Vadodara – 390 012, Gujarat, India
Corporate Office: Sun House, Plot No. 201 B/1, Western Express Highway, Goregaon – East, Mumbai - 400 063, Maharashtra, India
Tel: 022-43244324 CIN: L24230GJ1993PLC019050
Website: www.sunpharma.com Email: secretarial@sunpharma.com

NOTICE TO SHAREHOLDERS

To update KYC and claim unpaid dividends

The Company takes various facilitation measures to reduce unclaimed dividends, updating KYC and bank mandates from time to time to prevent the transfer of unpaid/unclaimed dividends and shares to the Investor Education and Protection Fund (IEPF).

The IEPF Authority has also launched a 100-Day Campaign, “Saksham Niveshak,” starting from 28 July 2025 to 06 November 2025, for KYC and other related updations, and collaborative efforts are being taken. The objective of this campaign is to facilitate shareholders for,

- Updating Know Your Customer (KYC) details, including Bank account mandates, Nominee registration, and Contact information - Email, Mobile number, Address, etc.
- Claiming unpaid/unclaimed dividends for any financial year(s) in order to prevent transfer to IEPF.

The Company has released communications to the concerned shareholders whose dividends remained unclaimed through individual notice(s), emails and SMS so that appropriate action(s) can be taken to claim the unpaid dividend.

The shareholders who have not yet claimed the dividends or have incomplete KYC records are requested to contact the Company's Registrar and Share Transfer Agenda, MUFG Intime India Private Limited, C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083, Phone: +91-8108116767, website: https://web.in.mpgms.mufg.com/helpdesk/Service_Request.html at the earliest. Additionally, shareholders are encouraged to register and track their requests through the SWAYAM portal: <https://swayam.in.mpgms.mufg.com>

Important Advisory

Please note that, as per applicable provisions, if dividends remain unclaimed for seven consecutive years, the dividend amounts and corresponding base shares, if any, shall be transferred to the IEPF. We urge all shareholders to take prompt action during the campaign period to safeguard their entitlements and ensure compliance with statutory requirements.

For Sun Pharmaceutical Industries Limited
(Anoop Deshpande)
Company Secretary and Compliance Officer
Nodal Officer for the purpose of IEPF
ICSI Membership No. A23983

Place: Mumbai
Date: 23 September 2025

HSBC MUTUAL FUND
NOTICE

Notice is hereby given that the Trustees of HSBC Mutual Fund have approved the declaration of dividends under the Income Distribution cum Capital Withdrawal (IDCW) option of the following scheme of HSBC Mutual Fund:

Sr. No.	Scheme/ Plan/ Option	Quantum of Dividend (in ₹ per unit)	NAV of the IDCW Option (as on September 22, 2025) (in ₹ per unit)
1.	HSBC Arbitrage Fund - Regular Plan - Quarterly IDCW Option	0.22	10.9979
2.	HSBC Arbitrage Fund - Direct Plan - Quarterly IDCW Option	0.25	11.1984

Record Date: September 26, 2025. Face Value: Rs 10 per unit

The above dividend is subject to availability of distributable surplus and may be lower to the extent of distributable surplus available on the record date. **Pursuant to payment of dividend, the NAV of the IDCW option of the above-mentioned scheme/ plans will fall to the extent of dividend distribution and statutory levy, if any.**

All the unitholders of the above scheme whose names appear on the register of unitholders as on the record date will be eligible to receive the dividend.

For & on behalf of **HSBC Asset Management (India) Private Limited**
(Investment Manager to HSBC Mutual Fund)

Sd/-
Authorised Signatory
Mumbai, September 23, 2025



Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

HSBC Asset Management (India) Private Limited, 9-11 Floors, NESCO IT Park, Building no. 3, Western Express Highway, Goregaon (East), Mumbai – 400 063, India.
Email: investor.line@mutualfunds.hsbc.co.in, Website: www.assetmanagement.hsbc.co.in
Customer Service Number - 1800 200 2434/ 1800 4190 200
Issued by HSBC Asset Management (India) Private Limited
CIN-U74140MH2001PTC134220

 સન ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ
 સન ઓફીસ: સ્પાર્ક, તાંદળખા, વડોદરા-૩૬૦૦૧૨, ગુજરાત, ભારત કોર્પોરેટ ઓફીસ: સન હાઉસ, પ્લોટ નં. ૨૦૧ બી/૧, વેસ્ટન એરપોસ હાઇવે, ઓરેન્જીવ- ૬૪૨૮, મુંબઈ- ૪૦૦ ૦૬૬, મહારાષ્ટ્ર, ભારત. ફોન : ૦૨૨ ૪૩૨૪૪૩૨૪ CİN: 24230CJ1993PLC019050 વેબસાઇટ : www.sunpharma.com ઇમેઇલ: secretarial@sunpharma.com
શેરહોલ્ડરોને નોટીસ
કેવાયસી સુધરાવાવા અને ન ચુકવાયેલ ડિવિડન્ડોનો દાવો કરવા માટે કંપની ઇન્વેસ્ટર એમ્યુફેશન અને પ્રોટેક્શન્સ ફંડ(આઈપીએફ)માં ન ચુકવાયેલ/ દાવો નકરાયેલ ડિવિડન્ડો અને શેરોના ટ્રાન્સફરફથી બચવા માટે સમયાંતરે કેવાયસીઅને બેંક મેન્ડેટમાં સુધારો કરીને દાવો ન કરેલે ડિવિડન્ડો ઘડાડવા માટે વિવિધ સવલતોના ગતિવા રહી હશે. આઈપીએફએ ઓગોસ્ટીએકેવાયસી અને અન્ય સંબંધિત સુધારાઓ માટે, ૨૮ જુલાઈ, ૨૦૨૫ થી ૦૬ નવેમ્બર, ૨૦૨૫ સુધી ૧૦૦-દિવસીયલ ઝુંબેશ સક્ષમ નિવેશક પણ શરૂ કરી છે અને સહઓગી પ્રયાસો કરાઈ રહ્યા છે. આ ઝુંબેશનો હેતુ શેરહોલ્ડરોને નીચેની સવલતો આપવાનો છે: – નો ચેક કરમર (કેવાયસી) વિગતો અને બેંક એકાઉન્ટ નેમ્બેરસ, નોમીની રજીસ્ટ્રેશન અને સંપર્ક માહિતી- ઈમેલ, મોબાઈલ નંબર, સરનામું વગેરે સુધારવાની – આઈપીએફમાં ટ્રાન્સફરફથી બચવા માટે કોઈપણ નાણાકિય વર્ષ(પો) માં ને ન ચુકવાયેલ/ દાવો ન કરાયેલ ડિવિડન્ડો માટે દાવો કરવાની કંપનીએ વ્યક્તિગત નોટીસ(સો), ઈમેલથી અને એસએમએસ મારફત લાગતા વાગતા શેરહોલ્ડરો જેમના ડિવિડન્ડો હજુ સુધી દાવો કરાયા નથી તેમને જણા કરેલ છે જેથી ન ચુકવાયેલ ડિવિડન્ડોનો દાવો કરવા માટે એવચ કાર્યવાહી(ઓ) કરી શકાય. જે શેરહોલ્ડરોએ હજુ ડિવિડન્ડો માટે હજુ દાવો કરેલ નથી અથવા અકસુર કેવાયસી ફેલોફ ધરાવે છે તે તેઓએ કંપનીના રજીસ્ટર અને શેર ટ્રાન્સફર એગ્રન્ટ, એમ્યુફેડગ્રન્ટઅથ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ, સી-૧૦૧, એમ્બસી રજી, એલ.બી.એસ માર્ગ, વિશ્વોલી (વેસ્ટ), મુંબઈ- ૪૦૦૦૮૩, ફોન: +૯૧-૮૪૦૮૧૧૬૪૬૬, વેબસાઇટ https://web.in.mpmns.mufig.com/helpdesk/service_Request.html નો વહેલી તકે સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, શેરહોલ્ડરોને સ્વયમ પોર્ટલ : https://swayam.in.mpmns.mufig.com માનફ્રટ તેમના અરજીઓ રજીસ્ટર અને ટ્રેડ ક્વાય પ્રોસેસીંગ કરવામાં આવે છે. અન્યનો સમાવ: નોંધ લેવી કે, લાગુ જેમવાળાઓ મુજબ, જો ડિવિડન્ડો સતત સાત વર્ષ સુધી દાવો ન કરાયેલ છે, તો ડિવિડન્ડની રકમો અને તેના સંબંધિત શેર, જો હોય તો, આઈપીએફમાં તબદીલ કરવામાં આવશે. અને તમામ શેરહોલ્ડરોને તેમના અધિકારોના બાવલ માટે ઝૂંબેશના ગાળા દરમિયાન ઝડપી કારવાહી કરવા અને કાનુની આવશ્યકતાઓના પાલનની ખાતરી કરવા અરજી કરીએ છીએ. સન ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી (નમુનુ દેખાવો) કંપની સેક્રેટરી અને કમ્પલાયન્સ અધિકારી આઈપીએફના હેતુ માટેના નોડલ અધિકારી આઈસીએસઆઈ મેમ્બરશીપ નં. એર૨૬૯૩
સ્થાન : મુંબઈ
તારીખ : ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫

એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ						
રજીસ્ટર્ડ ઓફીસ : સધિકા, બીજો માળ, લો ગાર્ડન રોડ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯						
રીજનલ / શાખા ઓફીસ : એચડીબી ફાયનાન્સીયલ સર્વિસ લીમીટેડ, નાય એડિફિક, ત્રીજો માળ, ડૉ. યાફાકિ રોડ, રાજકોટ-૩૬૦૦૦૭						
સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-હરાજીની જાહેર નોટીસ (જુઓ નિયમ ૮(૬) ની જોગવાઈઓ)						
ઇચેમડી અને દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ અને સમય : ૨૪/૧૦/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી						
સિક્યોરીટાઇઝેશન અને રીસ્કન્ટ્રફક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇવન્ટેસ્ટ (સરફેસી) એક્ટ, ૨૦૦૨, (૨૦૦૨ નો ૫૪) હેઠળ એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડને ગીરો કરાયેલ સ્થાવર મિલકતોનું વેચાણ.						
આથી એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રીસ્કન્ટ્રફક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇવન્ટેસ્ટ (સરફેસી) એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ ખતરી નોટીસ મુજબ એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડની બાકી રકમની વસુલાત માટે અમારી શાખામાં નીચેના લોન એકાઉન્ટોમાં નીચેની મિલકત/તોનો ભૌતિક કબજો “જ્યાં છે”, “જે છે” ના ધોરણે તેના વેચાણના હક સાથે લઈ લીધેલ છે. વેચાણ ઈ-હરાજી પ્લેટફોર્મ મારફત વેબસાઇટ https://www.bankeauctions.com દ્વારા નીચે સહી કરનાર દ્વારા કરવામાં આવશે.						
શાખાનું નામ અને એકાઉન્ટ	ગીરો મિલકતની વિગત, જે હરાજી વેચાણ હેઠળ છે અને કબજાનો પ્રકાર	માંગણા નોટીસની તારીખ	અધિકૃત અધિકારીની વિગત	ઇચેમડી જમા કરવા માટેની એકાઉન્ટ વિગતો	રિઝર્વ કિંમત	ઈ-હરાજીની તારીખ
		બાકી રકમ (સિક્કોર્ડ અધા)			ઇચેમડી	ઈ-હરાજીનો સમય
					બિડ વૃદ્ધિની રકમ	ઇચેમડી જમા કરવાની તારીખ
પહેલો માળ, શોપ નં. ૫૨૪, સર્વે નં. ૭૩૦, પોકેટ નં. ૨૫, લોર્ડ નં. ૪, મેટર રોડ, મેઇન બજાર પોર્ટ રોડ, શક્તિ નગર, ભચાઈ, કચ્છ, ગુજરાત-૩૭૦૧૪૦	મિલકત ૧ : એન.એ. પ્લોટ નં. ૧૧, સ્લેગફળ આણશે ૨૨૨.૯૫ ચો.મી., કોમ્પ્રાઇઝડ રેવન્યુ સર્વે નં. ૪૫ પૈકી, મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતેની સ્થાવર મિલકત (લોન નં. ૩૨૯૪૦૩૪૪) તેમજ આ મીલકતના સંબંધમાં તમામ સગવડના હક્કો અન્ય હક્કો અને હિતો.	૨૮-૦૪-૨૦૨૫ રૂ. ૭૫૯૭૧૪૧.૦૭/- (રૂપિયા પંચોતેર લાખ સત્તાવું હજાર એકસો એકતાલીસ અને સાત પૈસા પુરા)	શ્રી દુર્લભસિંહજી રાહોડે સંપર્ક નં. ૯૦૯૮૦૯૧૯૪૨ ઇમેઇલ આઇડી: LM.RAJKOT@HDBFS.COM	એકાઉન્ટ નં. ૦૦૨૧૧૦૩૧૦૦૦૨૭૩૧, એકાઉન્ટનું નામ એચડીબીએફએસ જબરલ રિસિપ્ટ, આઇએફએસસી કોડ: HDFC0000021 બેંક – એચડીએફસી બેંક લીમીટેડ	બધી ૭ મિલકતો માટે રિઝર્વ કિંમત : મિલકત ૧:- રૂ. ૫૦૬,૭૮૬૬ મિલકત ૨:- રૂ. ૩૭૭,૮૭૯૭ મિલકત ૩ થી ૭:- રૂ. ૪૪૯૧૦૮૭ રૂ. ૧૩૩૩૭૭૫/- (રૂપિયા એક કરોડ તેગીસ લાખ સાડઝીસ હજાર સાતસો પચ્ચાસ પુરા)	૨૭-૧૦-૨૦૨૫ સવારે ૧૧.૦૦ થી સાંજે ૦૫.૦૦ સુધી ભાગીદારો દ્વારા અપાયેલ સૌથી ઉંચી બીડ ખુલ્લા પછી પ મિનિટના અમર્યાદિત લંબાણ સહીત ઈચેમડી જમા કરવાની છેલ્લી તારીખ: ૨૪-૧૦-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી
૧. એ જી મીનરલ્સ, ૨. ગડુર ઇસ્માઇલ ખલિફા, ૩. ઇમરાન ખલિફા, ૪. અલી અબસમ ખલિફા (સ્વર્ગસ્થ) (તેના કાનુની વારસદારો મારફત)	મિલકત ૨ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૫ પૈકી, પ્લોટ નં. ૨૫ પૈકી પશ્ચિમ ભાગ, સ્લેબજ ઍરિયા ૧૧૧.૪૫ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત (લોન નં. ૩૨૯૪૦૩૪૪) તેમજ આ મીલકતના સંબંધમાં તમામ સગવડના હક્કો અન્ય હક્કો અને હિતો.	૨૮-૦૪-૨૦૨૫ રૂ. ૭૫૯૭૧૪૧.૦૭/- (રૂપિયા પંચોતેર લાખ સત્તાવું હજાર એકસો એકતાલીસ અને સાત પૈસા પુરા)		એમઆઇસીઆર કોડ: ૫૦૦૨૪૦૦૦૨	ઇચેમડીની રકમ : રૂ. ૧૩૩૩૭૭૫/- (રૂપિયા તેર લાખ તેગીસ હજાર સાતસો પંચોતેર પુરા)	
(એ) ખલિફા રોશનબાનું અલી (કાનુની વારસદાર)	મિલકત ૩ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૧૮, બિન્ટ અપ ઍરિયા ૧૯.૦૫ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ (લોન નં. ૩૨૯૪૦૩૪૪) તેમજ આ મીલકતના સંબંધમાં તમામ સગવડના હક્કો અન્ય હક્કો અને હિતો.					
(બી) ઇમરાન ખલિફા (કાનુની વારસદાર),	મિલકત ૪ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૨૫, બિન્ટ અપ ઍરિયા ૧૬.૦૩ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ (લોન નં. ૩૨૯૪૦૩૪૪) તેમજ આ મીલકતના સંબંધમાં તમામ સગવડના હક્કો અન્ય હક્કો અને હિતો.					
(સી) મોહમદ ઓવેસ ખલિફા (કાનુની વારસદાર)	મિલકત ૫ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૨૬, બિન્ટ અપ ઍરિયા ૧૬.૦૩ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ (લોન નં. ૩૨૯૪૦૩૪૪) તેમજ આ મીલકતના સંબંધમાં તમામ સગવડના હક્કો અન્ય હક્કો અને હિતો.					
૫. ખલિફા રોશનબાનું અલી, ૬. ખલિફા રોશન, તમામનું સરનામું :	મિલકત ૬ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૩૩, બિન્ટ અપ ઍરિયા ૧૮.૩૦ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ (લોન નં. ૩૨૯૪૦૩૪૪) તેમજ આ મીલકતના સંબંધમાં તમામ સગવડના હક્કો અન્ય હક્કો અને હિતો.					
એ) એ જી મીનરલ્સ સર્વે નં. ૫૬૧/૧, ભારત હોટેલ સામે, ગામ-ભચાઈ, કચ્છ-૩૭૦૧૫૦, ગુજરાત	મિલકત ૭ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૩૭, બિન્ટ અપ ઍરિયા ૧૮.૭૦ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ.					
બી) એનએ રેવન્યુ સર્વે નં. ૪૮/૩ પ્લોટ નં. ૪, ૫, ૬, ૭, પૈકી પશ્ચિમ ભાગ ૧૫, ૧૬ અને ૨૦ પૈકી ભચાઈ-૩૭૦૧૫૦ ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ.	મિલકત ૮ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૩૯, બિન્ટ અપ ઍરિયા ૧૮.૭૦ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ.					
સી) એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૫ પૈકી પ્લોટ નં. ૧૧ ઍરિયા ૨૨૨ ઍરિયા ૨૨૨.૯૫ ચો.મી., ગામ-સામખિયાળી, ભચાઈ-૩૭૦૧૫૦	મિલકત ૯ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૩૯, બિન્ટ અપ ઍરિયા ૧૮.૭૦ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ.					
ડી) મોરીવાસ સામખિયાળી કચ્છ, ગુજરાત, ભચાઈ-૩૭૦૧૫૦	મિલકત ૧૦ : એન.એ. રેવન્યુ સર્વે નં. ૪૮/૩, પ્લોટ નં. ૪, ૫, ૬, ૭ પૈકી પશ્ચિમ ભાગ, પ્લોટ નં. ૧૫, ૧૬ અને ૨૦ અને ૨૦ પૈકી પશ્ચિમ ભાગ, શોપ નં. ૩૯, બિન્ટ અપ ઍરિયા ૧૮.૭૦ ચો.મી., મુકામ-ગામ-સામખિયાળી, તાલુકો-ભચાઈ-કચ્છ, સબ રજીસ્ટ્રેશન જિલ્લો-ભચાઈ, રજીસ્ટ્રેશન જિલ્લો-કચ્છ, રાજ્ય-ગુજરાત ખાતે બંધાયેલ કોમર્સિયલ શોપ.					
	કબજો પ્રકાર : ભૌતિક કબજો					

શરતો અને નિયમો:

૧. અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી અને માહિતી હેઠળ કોઇપણ મિલકત પર બીજા નથી. આમ છતાં, ઇચ્છુક બીડરોએ તેમની બીડ જમા કરતાં પહેલા બીજા, હરાજી પર મુકાયેલ મિલકત/તોના ટાઇટલ અને મિલકતને અસરકાર્ત દાવાઓ/ હકો/બાકી રકમ અંગે તેમની જાતે સ્વતંત્ર ચકાસણી કરવી જોઇએ. ઈ-હરાજી જાહેરાત એચડીબી ફાયનાન્સિયલ સર્વિસ લીમીટેડના કોઇપણ કમીટમેન્ટ અથવા કોઇપણ રજુઆતની પુરક નથી અથવા પુરક ગણવામાં આવશે નહીં. મિલકત એચડીબી ફા યનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડની જાણમાં હોય કે ન હોય તેવા વર્તમાન અને ભાવી બોજાઓ સાથે વેચવામાં આવી રહી છે. અધિકૃત અધિકારી/સિક્કોર્ડ લેલદાર/કેઇપણ ગ્રાહીત વ્યક્તિના દાવા/હકો/બાકી રકમ માટે જવાબદાર ગણાશે નહીં.

૨. ઈ-હરાજી મિલકતોનો **સાંકેતિક કબજો** લીધા પછી “જ્યાં છે”, “જે છે” અને “જેમ છે” ના ધોરણે યોજાય રહી છે. સફળ બીડર/રોએ તે/તેમના ખર્ચ, જોખમ અને જવાબદારીઓએ મિલકતોનો ભૌતિક કબજો લેવાનો રહેશે. છતાં, બેંક સક્ષમ પ્રાધિકરણ પાસેથી આદેશ મેળવીને કબજો લેવાની સવલત કરશે. **૩.** બીડ જમા કરતા પહેલા મિલકતનું નિરિક્ષણ કરવાની અને મિલકત અને તેની વિગતો અંગે તેમની રીતે સંતોષકારક તપાસ કરવાની જવાબદારી બીડરની રહેશે. હરાજી પર મુકાયેલ મિલકત/તોનું નિરિક્ષણની ઇચ્છુક બીડરોને **૧૭.૧૦.૨૦૨૧ થી ૧૪.૦૮.૨૦૨૫** ના રોજ (ઓફીસ કલાકો દરમિયાન) પરચવાની આપવામાં આવશે.

૪. ઇચ્છુક બીડરોએ તેમની ઇચેમડી **વેબ પોર્ટલ : https://bankeauctions.com** મારફત (યુઝર આઇડી અને પાસવર્ડ <https://bankeauctions.com> પર વિના મુલ્યે નામ રજીસ્ટર કરીને મેળવી શકાશે.) લોગીન આઇડી અને પાસવર્ડ મારફત જમા કરવાની રહેશે. ઇચે બીડ ઉપર જણાવેલ એકાઉન્ટમાં એનઇએફડી દ્વારા ચુકવવાપાત્ર રહેશે. વેબપોર્ટલમાં બીડર દ્વારા રજીસ્ટ્રેશન (વનટાઇમ) કર્યા પછી, ઇચ્છુક બીડર/ખરીદારે બીડ દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ પહેલા વેબ પોર્ટલમાં નીચેના દસ્તાવેજોની નકલ અપલોડ કરવાની રહેશે. એટલે કે (૧) એનઇએફડી/આરટીજીએસ ચલન અથવા કીમાન્ડ ડ્રાફટની નકલ, (૨) પાનકાર્ડની નકલ, (૩) ઝોળાખના પુરાવા/સરનામાના પુરાવા (કેવાયસી) એટલે કે વોટર આઇડી કાર્ડ/ ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ વગેરે. જેના સિવાય બીડ રદ થવાને પાત્ર છે. જોડાણ ૨ અને ૩ ની સ્કેન્ડ નકલ અપલોડ કરવી (વેબ પોર્ટલ <https://bankeauction.com> પરથી ડાઉનલોડ કરી શકાશે) યોગ્ય રીતે ભર્યા પછી સહી કરવી પણ જરૂરી છે. લોગીન આઇડી અને પાસવર્ડ બનાવવા, બીડ દસ્તાવેજો જમા કરવા, ઓનલાઇન ઇન્ટર સે- બીડીંગ વગેરે પર તાલીમ/ડેમોરેશન માટે મદદ ઇચ્છતા ઇચ્છુક બીડરે **મેસસં સી.ઈન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ**, પ્લોટ નં. ૬૮, ૩જો માળ, સેક્ટર-૪૪, ગુરૂગૌવ, હરિયાણા-૧૨૨૦૦૩ ઈમેઇલ આઇડી : support@bankeauctions.com મો. નં.: + ૯૧-૭૯૨૯૮૧૯૧૧૨૪/૨૫/૨૬, ૯૯૪૪૯૧૮૨૨૨૨ નો સંપર્ક કરી શકે છે અને મિલકત સંબંધિત પુછપરછ માટે અધિકૃત અધિકારી: શ્રી દુર્લભ સિંહ રાહોડે મો: ૯૦૯૮૦૯૧૯૪૨ ઇમેઇલ આઇડી: lm.rajkot@hdbfs.com નો સોમવારથી શનિવાર સુધી કામકાજના કલાકો દરમિયાન સંપર્ક કરી શકે છે.

૫. રસ ધરાવતા બીડરોએ તેમના બીડ દસ્તાવેજો (ઇચેમડી (રિઝર્વ કિંમતથી ઓછી નહીં) અને જરૂરી દસ્તાવેજો (વિગત નં. ૪ માં જણાવેલ) **૨૪.૧૦.૨૦૨૫** ના રોજ સાંજે ૦૫.૦૦ વાગ્યા પહેલા જમા કરવા પડશે અને રજીસ્ટરીંગ પ્રક્રિયા (વન ટાઇમ) માંથી પસાર થયા પછી અને તેમના પોતાના યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા પછી ઇ-હરાજી પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક બનશે, જે અધિકૃત અધિકારીની મંજૂરી અથવા દસ્તાવેજોની ચોગ્ય ચકાસણીને આધિન રહેશે.

૬. ઓનલાઇન ઇન્ટર-સે- બીડીંગ દરમિયાન, બીડર બીડ વૃદ્ધિની રકમ (ઉપર જણાવેલ) અથવા તેના ગુણક મુજબ તેમની બીડની રકમ સુધારી શકે છે અને ઈ-હરાજી પુર્ણ થવાની છેલ્લી પ મિનિટ દરમિયાન બીડ થવાના કિસ્સામાં, બંધ થવાનો સમય ઈ-હરાજી બંધ થવાનો સમય ઓટોમેટીક પ મિનિટ (ઈ-હરાજી પ્રક્રિયા પુર્ણ થવાનો સમય) વધી જશે અથવા તે આપમેળે બંધ થશે. સૌથી ઉચી બીડની રકમ જમા કરનાર બીડર (રિઝર્વ કિંમતથી ઓછી નહીં) ઇ-હરાજી પ્રક્રિયા સમાપ્ત થતાં અધિકૃત અધિકારી/સિક્કોર્ડો લેલદાર દ્વારા ચોગ્ય ચકાસણી પછી સફળ બીડર તરીકે ઘોષીત કરાશે.

૭. સફળ બીડરની અનર્ન્ટ મની ડિપોઝીટ વેચાણની રકમના ભાગરૂપે કાનૂની બીડરોની ઇચેમડી પર કોઇ વ્યાજ મળશે નહીં. સફળ બીડરે વેચાણ કિંમતના ૨૫ ટકા પહેલેથી ચુકવેલ ઇચેમડી બાદ કરીને અધિકૃત અધિકારી દ્વારા બીડની રકમની મંજૂરી મળ્યાના ૨૪ કલાકની અંદર ચુકવાની રહેશે અને વેચાણ કિંમતના બાકીના ૭૫ ટકા વેચાણના ૧૫ મા દિવસે અથવા તે પહેલા અથવા અધિકૃત અધિકારીની સુચનુજન આધિન લેખીતમાં મળીલ મજૂરી મજબ આવા લંબાવેલ ગાળા દરમિયાન ચુકવવાના રહેશે. સફળ બીડર દ્વારા ચુકવાણીમાં કસુબના કિસ્સામાં, ઓફર દ્વારા જમા કરાયેલ રકમ જામ કરવામાં આવશે અને મિલકતની ફરી હરાજી કરવામાં આવશે અને કસુરવાર દેવાદાર મિલકત/રકમ બાબતે કોઇ દાવો/હક ધરાવશે નહીં.

૮. ભાવી બીડરો બીડરે ઈ-હરાજીની તારીખ પહેલા મેસસં સીઈ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ પાસેથી ઈ-હરાજી અંગેની તાલીમ મેળવી શકે છે. અધિકૃત બીડર/એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ અથવા **મેસસં સીઈ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ** કોઇપણ ઇન્ટરનેટ સમસ્થા માટે જવાબદાર ગણાશે નહીં

૯. ખરીદારે સ્ટેમ્પ ડ્યુટી/એડિશનલ સ્ટેમ્પ ડ્યુટી/ડાન્સફર ચાર્જ, ફી વગેરે અને તમામ કાનુની/ગિન કાનુની બાકી, વેરા, દરો, એક્સેસરન્ટ ચાર્જ, ફી વગરે ભોગવાના રહેશે.

૧૦. અધિકૃત અધિકારી સૌથી ઉચી ઓફર મારફત અધિકૃત અધિકારી અને અધિકૃત અધિકારી દ્વારા અધિકૃત અથવા વપરા કરવામાં આવશે. અનર્ન્ટ મની ડિપોઝીટ પર કોઇ વ્યાજ મળશે નહીં. અનર્ન્ટ મની ડિપોઝીટ પર કોઇ વ્યાજ મળશે નહીં. સફળ બીડરે વેચાણ કિંમતના ૨૫ ટકા પહેલેથી ચુકવેલ ઇચેમડી બાદ કરીને અધિકૃત અધિકારી દ્વારા બીડની રકમની મંજૂરી મળ્યાના ૨૪ કલાકની અંદર ચુકવાની રહેશે અને વેચાણ કિંમતના બાકીના ૭૫ ટકા વેચાણના ૧૫ મા દિવસે અથવા તે પહેલા અથવા અધિકૃત અધિકારીની સુચનુજન આધિન લેખીતમાં મળીલ મજૂરી મજબ આવા લંબાવેલ ગાળા દરમિયાન ચુકવવાના રહેશે. સફળ બીડર દ્વારા ચુકવાણીમાં

૧૧. બીડરોને તેમની બીડો જમા કરતા પહેલા અને ઈ-હરાજીમાં ભાગ લેતા પહેલા **મેસસં સીઈ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ** ના વેબ પોર્ટલ <https://www.bankeauctions.com> પર ઉપલબ્ધ વિગતવાર શરતો અને નિયમો જોવા સલાહ આપવામાં આવે છે.

૧૨. આ પ્રકાશન કાનુની ધારાને આધિન છે.

ખાસ સુચના
૧૩. બીડરોએ છેલ્લી ક્લાઓમાં બીડીંગને ટાળવું જોઇએ કારણકે કોઇપણ ખામી/નિષ્ફળતા/ઇન્ટરનેટ નિષ્ફળતા/પાવર નિષ્ફળતા વગેરે) માટે એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ અથવા સર્વિસ પ્રદાતા જવાબદાર ગણાશે નહીં, આવા વિપરિત સંજોગોને ટાળવા માટે, તમામ જરૂરી ગોઠવણો/ વિકલ્પો જેવા કે પાવર સપ્લાય બેકઅપ વગેરે તમામ કરી રાખવા બીડરોને વિનંતી છે, જેથી તેઓ આવી વિપરિત પરિસ્થિતિઓને ટાળી શકે અને હરાજીમાં ભાગ લેવા માટે સક્ષમ બની શકે.
સરફેસી એક્ટ, ૨૦૦૨ હેઠ